

અરજદારની ફોજદારી કાર્યરીતી અધિનિયમ ની કલમ ૪૫૧ અને ૪૫૭ મુજબની અરજી લગત હુકમ

અરજદારની હાલની અરજી વંચાણે લીધી.અરજદાર તથા વિધવાન એ.પી.પી. શ્રી ને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજી માં જણાવ્યા મુજબના સરનામે હાલમા રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના (1) AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 912010035892994 IFSC CODE-UTIB0004021, માંથી રુપીયા 150000 (2) તેઓના પિતાજીના AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 917020027100777 IFSC CODE-UTIB0001659, માંથી રુપીયા 42000 ઉપડી ગયેલ હતા. જે બાબતે તેઓએ આશ્વસ્ત પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ તારીખ 11/06/2024 ના રોજ 31106240087290 ટીકીટ નંબરથી નોંધાયેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ ધ્વારા સામાવાળાના (1) HDFC BANK ના ખાતા નં. 50200076336074 IFSC : HDFC0009956 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 50000 (2) INDIAN BANK ના ખાતા નં. 7162774333 IFSC : IDBI000B027 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 13513 (3) SBI BANK ના ખાતા નં. 37895009307 IFSC CODE : SBIN0004898 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 (4) BANK OF INDIA ના ખાતા નં. 140210100017178 IFSC CODE : BKID0001402 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 રુપીયા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ની કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર થયેલ નથી. તેઓને ખુબજ મોટુ આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રુપીયાની જરુર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ની કલમ ૪૫૧ અને ૪૫૭ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગરનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર નાઓએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણા જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર ધ્વારા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ હસ્તક ચાલુ છે અને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે આ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરજ બજાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ માં સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર નાણા જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ ના ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરીયાદ ૧૦૦ નંબર(હાલ ૧૯૩૦) પર ડાયલ કરીને

લખાવે છે ત્યારે ઈન્સડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટીકીટ નંબર આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરીકના નાણા ગયેલ હોય તે બેંકને નાણા ફીઝ કરાવવા તેમજ જો નાણા ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી સીઆરપીસીની કલમ ૯૧ તથા ૧૦૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણા ફીઝ કરવામાં આવે છે. નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર નાઓએ વધુમાં જણાવેલ છે કે, હાલના અરજદાર દિલશાદહુસૈન ઈરસાદહુસૈન અંસારીનાઓ સાથે સાયબર ક્રાઈમનો બનાવ બનેલ હતો. જેમાં અરજદારની બેંક (1) AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 912010035892994 IFSC CODE-UTIB0004021, માંથી રુપીયા 150000 (2) તેઓના પિતાજીના AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 917020027100777 IFSC CODE-UTIB0001659, માંથી રુપીયા 42000 ઉપડી ગયેલ હતા. જે બાબતે અરજદારે આશ્વસ્ત પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને પોતાની ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ આધારે અરજદારને નં. 31106240087290 આપવામાં આવેલ. આ અરજદારની ફરીયાદ આધારે સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણા પૈકી સામાવાળા શંકાસ્પદ બેંક (1) HDFC BANK ના ખાતા નં. 50200076336074 IFSC : HDFC0009956 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 50000 (2) INDIAN BANK ના ખાતા નં. 7162774333 IFSC : IDBI000B027 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 13513 (3) SBI BANK ના ખાતા નં. 37895009307 IFSC CODE : SBIN0004898 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 (4) BANK OF INDIA ના ખાતા નં. 140210100017178 IFSC CODE : BKID0001402 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 રુપીયા સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણા પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સારુ તેઓનો અભિપ્રાય માગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે અરજદારશ્રીનાઓના સામાવાળા શંકાસ્પદ બેંક (1) HDFC BANK ના ખાતા નં. 50200076336074 IFSC : HDFC0009956 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 50000 (2) INDIAN BANK ના ખાતા નં. 7162774333 IFSC : IDBI000B027 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 13513 (3) SBI BANK ના ખાતા નં. 37895009307 IFSC CODE : SBIN0004898 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 (4) BANK OF INDIA ના ખાતા નં. 140210100017178 IFSC CODE : BKID0001402 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 રુપીયા ફીઝ થયેલ છે જે સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાયેલ છે તથા સદરનું ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રુપીયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા તે હકીકત સ્પષ્ટ થાય છે કે હાલના અરજદારના બેંક (1) AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 912010035892994 IFSC CODE-UTIB0004021, માંથી રુપીયા 150000 (2) તેઓના પિતાજીના AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 917020027100777 IFSC CODE-UTIB0001659, માંથી રુપીયા 42000 ઉપડી ગયેલ. તેમજ સદર નાણા શંકાસ્પદ બેંક (1) HDFC BANK ના ખાતા નં. 50200076336074 IFSC : HDFC0009956 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 50000 (2) INDIAN BANK ના ખાતા નં. 7162774333 IFSC : IDBI000B027 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 13513 (3) SBI BANK ના ખાતા નં. 37895009307 IFSC CODE : SBIN0004898 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000

(4) BANK OF INDIA ના ખાતા નં. 140210100017178 IFSC CODE : BKID0001402 ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી 25000 ખાતામાં ગયેલ હોય અરજદાર દ્વારા આશ્વસ્ત પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદ તારીખ 11/06/2024 ના રોજ 31106240087290 ટીકીટ નંબરથી નોંધાયેલ હતી. આમ સદર હકીકત ધ્યાને લેતા અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણા ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદઉપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા હાલના કામે આજદીન સુધી કોઈ એફઆઈઆર થયેલ હોય કે હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાની અત્રેની અદાલત સમક્ષ માગણી કરતી કોઈ અરજી કરેલ નથી તદઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતા તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાની માગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણા અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાનો કબજો મેળવવા હકકદાર હોવાનું જણાય છે.

આ તબક્કે સદર નાણા પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ની કલમ ૪૫૭ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છ

457. Procedure by police upon seizure of property.

(1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry or trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of such property.

(2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation.

આમ ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૭(૧) માં જણાવ્યા મુજબ જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જપ્તીની જાણ મેજીસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજીસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબજા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે તદઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગોવિંદભાઈ તેજાભાઈ બારીયા વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૧ (૨) જીએલએચ ૭૨૬ ના કેસમાં પેરા નં. (૯.૨), (૧૦) તથા (૨૨) મા પણ નીચે મુજબ ઠરાવેલ છે.

(9.2.)Shri Pandya has cited so many authorities with regard to legal possession of Sec. 451 and Sec. 452 of CrPC Here in this case owner lodged a complaint in the police station for which offence has been registered for theft having been committed in respect of two vehicles. That two vehicles have been found from the possession of the purchaser but at the same

time the Investigating Officer has come to a conclusion that complainant has filed a false case and therefore muddamal vehicles are seized during the course of the police investigation and Investigating Officer has reported about such seizure of two vehicles, from the purchaser to the Court and therefore Section 457 of CrPC will be applicable. In no case Sec. 451 Cr. P.C. will be applicable to this case. Sec. 457 of Cr. P.C. reads as follows:

"Sec. 457 Procedure by police upon seizure of property:

[(a) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry of trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of such property.]

"(2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall in such case issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation."

(10.) On reading aforesaid section, it is crystal clear that words "may make such order as he thinks fit" are of much importance. When word 'may' is used discretion has been given to the learned Magistrate, of course that discretion is to be exercised judicially keeping in mind the well settled principles of law. The words "to the person entitled to the possession thereof" are also important and relevant. **From the papers if the learned Magistrate has come to a conclusion that particular person is entitled to the possession of the vehicles then he can pass the order directing the muddamal article to be handed over to that person.** From record it appears that the purchaser has paid Rupees 3,10,000/— to the owner of the vehicles and Society was knowing about the fact that owner has already sold vehicles to purchaser.

(22.) As discussed earlier, when the learned Magistrate has followed the decision of this Court, in Hussain Amibhai Qureshi (supra), it cannot be said that he has passed an order contrary to well settled legal position with regard to return of muddamal articles under Sec. 457 of CrPC pending the inquiry.

આમ ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણા બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ ધ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩ (૧) જી.એલ.એચ.પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

હુકમ

અરજદારની અરજી આથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૭ હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.

અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂ. 113513 પુરા દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલીજ રકમના સઘ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરુપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

વધુમાં હુકમ કરવામાં આવે છે કે અરજદાર ધ્વારા હુકમ મુજબના જાત જામીન(બોન્ડ) તથા સઘ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારી ધ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેન્કને કરવી તેમજ HDFC Bank, Indian Bank, SBI Bank, Bank of India ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી ધ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સઘ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન- ૧૦ માં તેમની બેંકમાંના (1) HDFC BANK ના ખાતા નં. 50200076336074 IFSC : HDFC0009956 ખાતામાં તેઓના ગચેલ નાણા પૈકી 50000 (2) INDIAN BANK ના ખાતા નં. 7162774333 IFSC : IDBI000B027 ખાતામાં તેઓના ગચેલ નાણા પૈકી 13513 (3) SBI BANK ના ખાતા નં. 37895009307 IFSC CODE : SBIN0004898 ખાતામાં તેઓના ગચેલ નાણા પૈકી 25000 (4) BANK OF INDIA ના ખાતા નં. 140210100017178 IFSC CODE : BKID0001402 ખાતામાં તેઓના ગચેલ નાણા પૈકી 25000 અરજદારના (1) AXIS Bank ના ખાતા નંબર/ક્રેડિટ કાર્ડ 912010035892994 IFSC CODE-UTIB0004021, માં રુપીયા 113513 જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણા અદાલત સમક્ષ રજુ કરવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણા પર કલેઈમ કરે અને પોતાનો હક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.
- (૩) આ કેસનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અરજદારે સદર મુદ્દામાલ રોકડ નાણા અન્ય કોઈને ગીરો,બક્ષીશ કે અન્ય કોઈરીતે ટ્રાન્સફર કરવા કરાવવા નહી.
- (૪) સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહીત કામે ઉપયોગ કરવો/કરાવવો નહી.
- (૫) કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ તા. ૧૪, સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ વાંચી સંભળાવી મારી સહી કરી જાહેર કર્યો.

તા.૧૪/૦૯/ ૨૦૨૪
મુ.અમદાવાદ.

(શક્તિસિંહ ઘનશ્યામભાઈ ચાંચુ)
૨૦ માં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ,
અમદાવાદ.
CODE NO. GJ00885